

સંયુક્ત પસંદગી સમિતિ નાણા વિભાગની વર્ગ-૩ ની વિવિધ સંવર્ગની પેટા હિસાબનીશ અને સીનીયર કારકુનની જગ્યા માટે પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ, સાથે લાવવાના પ્રમાણપત્રો તેમજ રજૂ કરવાની વિગતોની યાદી

સંયુક્ત પસંદગી સમિતિ નાણા વિભાગની વર્ગ-૩ ની વિવિધ સંવર્ગની પેટા હિસાબનીશ, સીનીયર કારકુનની જગ્યા માટે તા.૧૬મી સપ્ટેમ્બર, ૨૦૧૨ ના રોજ ઓ.એમ.આર પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવેલ હતી. આ પરીક્ષા અન્વયે પ્રમાણપત્રોની ચકાસણી માટે અનામત તેમજ બીજા અનામત વર્ગોના ઉમેદવારોના નામોની પ્રથમ યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. તે યાદી પરના તમામ ઉમેદવારોને તા.૨૫-૦૮-૨૦૧૨ ના રોજ ૧૧.૦૦ કલાકથી સાંજના ૧૮.૦૦ કલાક દરમિયાન સરકારી વાણિજ્ય કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે નીચે મુજબના પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા જરૂરી પ્રમાણપત્રોના વેરીફિકેશન માટે નીચે મુજબના કાર્યક્રમ મુજબ અચૂક હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.

પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ

ક્રમ	સંવર્ગ	તારીખ	સમય
૧	પેટા હિસાબનીશ	૨૫-૦૮-૨૦૧૨ ૧૧.૦૦ થી ૧૬.૦૦ કલાક	
૨	સીનીયર કારકુન	૨૫-૦૮-૨૦૧૨ ૧૬.૦૦ થી ૧૮.૦૦ કલાક	

ઉમેદવારે લાવવાના પ્રમાણપત્રો તેમજ રજૂ કરવાની વિગતોની યાદી

- ૧) ઓજસ મારફતે ઓનલાઈન અરજી કર્યા અંગેનું પ્રિન્ટ આઉટ
- ૨) જન્મ તારીખનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ નોંધણી પ્રમાણપત્ર)
- ૩) જે તે સંવર્ગમાં નિયત કરેલ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- ૪) જાતિ અંગેનું પ્રમાણપત્ર
- ૫) સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૬-૨-૧૯૯૬ ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ (ક) તા.૩૧-૩-૨૦૧૧ ના રોજ પુરા થયેલ સને ૨૦૧૦-૧૧ ના નાણાકીય વર્ષની આવકને ધ્યાને લઈને તા.૦૧-૦૪-૨૦૧૧ થી તા.૦૫-૧૨-૨૦૧૧ સુધી યોગ્ય સત્તાધિકારીએ આપેલ પ્રમાણપત્ર.
- ૬) વિકલાંગ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તા.૧-૧૨-૨૦૦૮ના પરિપત્ર ક્રમાંક:પરચ-૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ.૨ થી નિયત થયેલ સુપ્રિન્ટેન્ડેન્ટ /સીવીલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર.
- ૭) માજી સૈનિકો તથા ઈ.સી.ઓ / એસ.એસ.સી.ઓ. સહિત જેમણે લશ્કરી સેવાઓ ઓછામાં ઓછી પાંચ વર્ષની ફરજો બજાવેલ હોય અને લશ્કરી સેવા માટે શારિરીક અશક્તતાના કારણે બરતરફ કે છૂટા કરવાના કારણોસર મુદત પુરી થયેથી (જેમની મુદત છ માસમાં પૂર્ણ થનાર હોય તેઓ સહિત) છૂટા થયેલ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
- ૮) વિધવા ઉમેદવારે પતિના અવસાન અંગેનું પ્રમાણપત્ર, વિધવા હોવા બાબતનું તેમજ પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રતિષ્ઠિત વ્યક્તિનું પ્રમાણપત્ર તથા રૂ.૨૦ ના સ્ટેમ્પ પર કરેલ સોગંદનામાની અસલ નકલ. (સામેલ નમૂના મુજબ)

- ૯) કોમ્પ્યુટર કૌશલ્ય અંગેની સી.સી.સી. પરીક્ષા અથવા અન્ય પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર.
૧૦) રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તે અંગેનું સરકારશ્રી દ્વારા નિયત કરેલ પ્રમાણપત્ર.
૧૧) ઓળખ, સારી ચાલચલગત અંગેનું ફોટાવાળા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પ્રમાણપત્ર.
૧૨) જો આ અરજી કર્યા સમયે ગુજરાત સરકારના કર્મચારી હોય અને આ જાહેરાત સંદર્ભમાં બારોબાર અરજી કરેલ હોય તો તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ /ખાતા /કચેરીને દીન – ૭માં જાણ કર્યાની નકલ તથા વિભાગ /ખાતા /કચેરી તરફથી ના વાંધા પ્રમાણપત્ર આપેલ હોય તો તેની નકલ.

ઉમેદવારોએ ઉપરોક્ત દર્શાવેલ પૈકી તેઓને લાગુ પડતા અસલ પ્રમાણપત્રો તેમજ દરેક પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત કરેલ બે નકલ, તાજેતરમાં પડાવેલ બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા ઉમેદવારનું ફોટો સાથેનું આઈડેન્ટિટી કાર્ડ (જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ) તથા તેની નકલ સાથે ઉપર જણાવ્યા મુજબની તારીખ, સ્થળ તથા સમયે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે કોઈ ઉમેદવાર ઉપરોક્ત જણાવ્યા સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ આ જગ્યા પર નિમણૂંક મેળવવા ઈચ્છતા નથી તેમ માની આગળના ક્રમાંકના ઉમેદવારોને તક આપવામાં આવશે અને ત્યારબાદ તેઓનો આ જગ્યા માટે કોઈ હક્કદાવો રહેશે નહીં.

ખાસ નોંધ:-

પ્રમાણપત્રો ચકાસણીના આ કાર્યક્રમનો હેતુ ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી કરતી વખતે જે માહિતી દર્શાવેલ છે તે તથા જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી / ખરાઈ કરવાનો હોવાથી આ કાર્યક્રમમાં હાજર રહેવાથી આપ નિમણૂંકને હક્કદાર બનતા નથી જેની ખાસ નોંધ લેવી.

સંયુક્ત પસંદગી સમિતિ, નાણા વિભાગ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક:/૨૦૧૧૧૨ અન્વયે
.....ના સંવર્ગ માટે વિધવા ઉમેદવારે કરવાનું સોગંદનામું

(રૂ. ૨૦/- કે તેથી વધુ રકમના સ્ટેમ્પ પેપર ઉપર અથવા તો અધેસીવ સ્ટેમ્પ લગાડીને)

- સો ગં દ ના મું -

આથી અમોતે
શ્રી.....ના પુત્રી
રહેવાસી.....સોગંદપૂર્વક જાહેર કરીએ છીએ
કે, અમારા લગ્ન તા.....ના
રોજ.....સાથે થયા હતા. અમારા પતિનું
તા.....ના રોજ અવસાન થયેલ છે. (મરણનો દાખલો સામેલ છે.)

સંયુક્ત પસંદગી સમિતિ, નાણા વિભાગ, ગાંધીનગરની ઉક્ત જાહેરાત અન્વયે
અમોએ.....ની જગ્યા માટે અરજી કરેલ છે. જે અન્વયે
અમો અરજીની તારીખે તેમજ આજની તારીખે વિધવા છીએ અને અમોએ પુનઃલગ્ન કરેલ નથી.

ખોટું સોગંદનામું કરવું એ ગુનો બને છે તે બાબતની અમોને જાણ છે. અને જો આ
સોગંદનામું કોઈપણ તબક્કે ખોટું સાબિત થશે તો અમારો નિમણૂક માટે કોઈ હકક રહેતો નથી.
અમારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકશે.

સહી.....

સાક્ષી.....

(૩૫૩ નોટરી/ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ)